

ભક્ત - કવિ શ્રી દ્વારામ ભાઈ હૃત

મહિત - પોપળ

ફા અં ગ લા ચ ર છુ ફા

શ્રી ગુરુ વરલભ દેવને, હું પ્રથમ કરું પ્રથમ;
શ્રી ચિહૂલ, શ્રી હૃષ્ણ, શ્રી યમુને મહા પૂર્ણ કામ.

પૂર્ણ કા મ દા મો હ ર દા સ,

અદ સખા પૂરો ઉર વાસ;

શુભ મતિ ધો અતિ પરમ પવિત્ર,

‘ભક્તિ - સુપોપણુ’ ગાંઠિ ચરિત્ર...

સેવો શ્રી હૃષ્ણ હૃપાળ...!

ફા સિદ્ધાંત - સાર ફા

બાર વિદ, ખર શાસ્ત્રનો, વારે વારે કર્યો રે વિચાર;
ઉપર્નિષદ્ધના અર્થનો, શોધતાં નીકળ્યો સાર.

નીકળ્યો સાર શ્રી હૃપણુની ભક્તિ,

અત્મંગમાં કર્યો આ સંક્રિતા;

શ્રી - પૂર્ણ - પુરુષોત્તમને થુગ - ચરણે,

સર્વ સરપરીને રહેતું શરણે...સેવો. ર

નાદી કોઈ જેની સમાવડી, કોઈ ઈશ ન જેને શીરા;
સર્વ વસ્તુ તે અકી થઈ, જે કોઈ કહાવે સર્વ ના આધીરા.

સર્વાધીશ વહે સહુ જોને,

નિગમ 'નેતિ નેતિ' કહે છે તેને;

શૈપ - મહેશ - વિધિ - શ્રી - અગન્ય,

તેને કહીએ પૂજું પુરુષોત્તમ...સેવો. ૩

શ્રી પુરુષોત્તમને પરહરી, જેનું અન્ય અમૃતે મન માણે;
તે કામદુલ્બા ભળી મૂકીને, મહિષી પુત્રનું પણ હોડે.

હોડે ગાય મૂકી મૂઢ પાડો,

તરસ્યો ગંગા-તીરે ખોડે આડો;

તેમ પૂર્ણ તણ અવર આરાધે,

મહેનત માથે પડે કાંઈન લાધે...સેવો. ૪

રાખી ભરેંસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશા;
હુંચે અખિલ હુઃઘ વામવા, વળી શ્રેય થવા મન આરાશા.

આરા કરે તરવા હધિ - પૂર,

શાનતું હાથ અહી લંગૂર;

તે જોવો રામરો સાગર પાર,

તરશે તેવો હરિ-વિમુખ સંસાર...સેવો. ૫

કોઈ ઉપાસન મહિનનું, જનનું તાત્કા નુદ્રા સમ જાંનું;
રૂપેયો સુર - સેવના, વ્યૂહ કંચન મહેસુર પ્રમાણું.

કંચન મહેસુર વ્યૂહ, હરિ હીરો,

એમ અંશ અંશી સમજી રહો;

સર્વ એ દ્રવ્ય હીરાથી થાય,

હીરો કોઈ એ કથોં નવ કહેવાય...સેવો. ૬

જગત વૃક્ષ, તેહનું મૂળ હરિ, મૂળ પોપણ વૃક્ષ પોપણાય;
પ્રતિ શાખા જળ સિંચિયે, તેથી તરેનર તુર્પિત ન થાય.

તુર્પિત ન થાય, વૃથા અમ પહેંચે,

અમબલાં આવે ત્યારે પછી શોચે;

મુખ દુરા સહુ ધર્મિય સતેચે,

બોજન ચાગે લેખ્યું કોઇને ન પોષે...સેવો. ૭

દુર્ઘટા સ્વરભાવ ઓ કૃષ્ણનો, જનતા અવગુજુ પણ ગુજુ જાણે;
અવગુજુ પડે અન્ય દેવને, સાસું દુઃખ હે શરૂ પ્રમાણે.

પ્રમાણું નહિ, ફળ હે તોહે જાય,

હસ્તિનું આખ્યું કેદી નારા ન થાય;

અમર ચાદ્ર વર, અધિક પ્રયત્ન,

પ્રભુ કેદી સાદે હે રતન...સેવો. ૮

ફં ભક્તિ ફં

દુર્ઘટ પીઠનાં કંને નીકળે, જળ મધ્યે જો નરનીત હોય;
મુંગ રાગદીં કંન ગુંધા રણે તોય, હરિ ભક્તિ વિના ભદ્ર ન હોય.

ન સૌય અદ્ર હરિ વિના કઢાપિ,

અસ્ત્ર ન હરિ વિના કો શકે આપી;

દું નથી કહેનો પોકારે લે વેદ,

દુઃમદૈ શી દુઃખું એણે સહુ ઐદ...સેવો. ૯

નંગાંદીન સુદૂ દેવા, પાત્ર વિરાસ પણ વરા થાય;

પ્રાણી અભ્રને જરૂર અગે, પણ પુરુષોત્તમ પ્રેમે પ્રમાય.

પ્રેમ ભક્તિ - વરા પૂર્વાનંદ,

એ ન પડે, અન્ય સાધન કેદ;

શ્રીમુખે ભાગયું ગીતા માંદ,
ત માનો તો કો કો ત્યાંય...સેવો. ૧૦

ફુલ નવદ્યા અકિત ફુ

અવાય, કીર્તન શ્રી કૃષ્ણનું, રમરાય, સેવન, અર્થાન;
વંદન, વાસત્વ, સુખયતા, વળી આત્મ-નિવેહન.

આત્મ - નિવેહન નવદ્યા કહિયે,

પ્રેમ - લક્ષ્માણ દર્શામી વહિયે;

એ અકિત સાહુ સાધન - તાજ,

કો પામે વરા થાય પ્રજ્ઞાણ...સેવો. ૧૧

અવાય પરીક્ષિત, શુક કરી કીર્તન, રમરાય કરી પ્રહૃતાદ;
શ્રી સેવન, પૂજન પૃષ્ઠ, વંદન આ હુરે આષ્ટાદ.

આહૃતાદ માન્યો, કુપીરા કિરેતા,

સુખયતા - અકિત સુભાડા - કાર્તા;

આત્મ - નિવેહન બલિયે કીધી,

ગોપીજને પ્રેમ લક્ષ્માણ લીધી...સેવો. ૧૨

ફુલ અવાય અકિત ફુ

નામ કેશરનું કર્ણમાં પડતાં સહુ થાય પવિત્ર;
શારેદ કદતુના સંગર્થી, કેમ નિર્મણ નીર વિચિત્ર.

વિચિત્ર જળ તેમ જતિ રૈ જાણ્ણો,

સર્વ શુદ્ધ સાધ નામે પ્રમાણ્ણો;

શુદ્ધ મુવળ્ણ જોતું અદિનથી થાય,

માંજે ઓષે તેવો મૈત્ર ન જાય...સેવો. ૧૩

ફ કીર્તન ભક્તિ ફ

નામ કીર્તન આ હૃદયનું, કળિમાં સહુ સાધન તાજ;
જન્મ સાગરે તરવા તણી, સહુને એ મુખ પથ પાજ.

પાજ પ્રગટ, અમ નહિ, ઘણું સહેલું;
હામ વિના ઇન થાય સહુ પહેલું;
સર્વ અવસ્થામાં ને સૌ ઠોર,
અધિક ઉત્તમ સૌને અધિકાર...સેવો. ૧૪
સત્યાગ્રહ કે ઝળ દ્યાનથી, થાતું ત્રૈતામાં યજાથી નેહ;
કાપેં પૂજને પામતાં, સહુ કળિ હરિ - કીર્તને તેહ.

તે થકી(પણ) અધિક ઝળ હરિ ગુણું ગાતાં,
તો શુ થયું તપ તીર્થમાં નાહાતાં ?
મહિયુ મહયો તે શોધે શીઠ કોઈ ?
વિના વિક્ષાસે મૂઢ ભરે દોઈ...સેવો. ૧૫
કંગિ રૂપી આશોયમાં, કોઈ કર્મનો નહિ અધિકાર;
અને ન મુજાક નામને, નિર્ભય નિર્ભય ઉચ્ચાર.

ઉચ્ચાર માને અભય પહ આપે,
મુક્તન પાપ સંતાપને કાપે;
તેદ રાન્ન સહુ પુરાણ પૈકારે,
તો હારેહરિ, તું શોં ના ઉચ્ચારે ?...સેવો. ૧૬
નાને અજ્ઞાનિઃ ઉદ્યો, નામે તાર્યો શિવે બહુ પાપી;
અત્યે નામે વાદમીક તર્યો, અધ્યે ગુણુકા ગતિ આપી.
આપી ગતિ દૃત્યાહિક ખાહુને,
જેણે જેણે આશ્રય કર્યો તે સહુને;

એ અક્ષરમાં અ ધોય સાર,
જોણે લદ્દો તે પારદો પાર...સેવો. ૧૭

સનેહ સહિત શ્રી કૃષ્ણનું, કથા કીર્તન જ્યાં નિત્ય થાય;
કેળિ તીવ્ય આવી ત્યાં વસે, કેનું ભાગ્ય હોય તે હાય.

નહાય તેમાં તે પવિત્ર પ્રમાણું,
તે વિના સર્વને સૂતકી જાણું;
જીવતાં શાખ સરખા સહુ તેહ,
ભૂતદે ભાર કરો ધરી હેહ...સેવો. ૧૮

ફુ સમરણ અક્તિં ફુ

નરપર છથિય નંદલાલની, એવું ચિંતન કરે ચિત્ત માંદિ;
માર સુકૃત શિર તિલિક કુંળા, નક્કેસર ચિલ્લક સાહાય.

સોહે કૌસ્તુભ સુ ઝા વન ભાળ,
કિં કિલ્લી કર આહી મુરલી રસાળ;
પી તાં અ ર કટિ મે ખ લા સોહે,

નેપુર ન ખ શિખશું છથિય મન મોહે...સેવો. ૧૯
સોળ ચિહૂન પદ - પંકો, દક્ષિણે નવ, વામે સાત;
સ્વસ્તિક, અષ્ટકોણ, જાયુદીણ, ધર,

પવિ, ધર, ઓંદ્રેખા વિશ્વાત.

દ્વાતે આ કુશ, આ ખુજ, મચ્છ, ચોમ,
કળશ, દાન્ડધતુ ને અધ્રો સોમ;
ત્રિકોણ, ગોપદ, ખદ્દરા ક્ષ્યાન.

નિત્ય કરે નિર્બિદ્ય - પદ - હાત...સેવો. ૨૦

લેમ નર - હૃગ હોરમાં, પતિહારીની બેડા માહે;

ચિત્ત પરસ્પર જારતું, વળાયું રહે ત્યાંતું ત્યાંહે,

ત્યાંહાં તેમ ચિત્ત પ્રખુમાં નિત્ય હેતું,

અંસારમાં સાક્ષીવત રહેતું;

જગત જાળે જે એ છે જ'લળી,

રાખે હુદે ત્રિકુમશું તાપણી...સેવો. ૨૧

કંસ, શિશુ પાળ, કુલજાહેકે વૈરે - કામે સમર્થા શ્યામ; એ વિના નાના આવથી, સમર્થે સર્થા સર્વનાં કામ.

કામ થથાં તુચ્છ ભાવે જથારે,

શું કહેતું સનેહે સમરે પછી ત્યારે ?

ચિત્ત અચળ જેતું કૃષ્ણામાં ભાગ્યું,

તો ભવસાં કટ સહુ તેતું ભાગ્યું...સેવો. ૨૨
અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું મુખ ?
સુપામાં આનંદ ઉભયને, માટે અજ્ઞાનાનંદ જ મુખ્ય.

સુપથ સેવન તે સુખી પ્રખુ કરવા,

ઓક બેહના ભય નવ ધરવા;

પૂજા તે ચાલે શુતિ પ્રમાણુ,

સેવા તે જેમાં સનેહ બંધાણુ...સેવો. ૨૩

એક વાર આખા જામમાં, જો શ્રી કૃષ્ણ-યરણ સમરાય;
તો હર્ષન પમ હૃતનું, કહી સરોને પણ નવ પાય.

થાય જો ભાવ અહિત નિત્ય, દ્યાન,

તો પછી શું કહું ભાગ્યનું ભાન ?

હરિ તેર નાહ તો તપે શું થાય ?

જો છે તો કરે કૃષ્ણ બલાય...સેવો. ૨૪

ફુલ પાદ-સેવન ભક્તિ ફુલ

આર્થું ઉરસ્થળ મૂડીને, રમા ચરણ-સેવા નવ ચૂકે;
હૃદ્ય રહિત કરા હરિ કરે, પણ પહોથીત નહિ મૂકે.

મૂકે ના આધ્યિ છે ભક્તિ-નિવાસ,
માટે અવલંબે સહુ હાસ;
એ ભક્તિ છે આતિશો દુર્લભ,
પ્રાણિ થયે સર્વે પહ સુલભ...સેવો. ૨૫

ફુલ અચ્યાન ભક્તિ ફુલ

હરિ વ્યાપક લદી સર્વમાં, નવ આખુંબો કોઈનો હોપ;
મન-કુમ્ભ-વચને જેમ બને તેમ, કરવો સર્વને સંતોષ.

સંતોષે પ્રાણી, પ્રભુ પ્રભાગ,
તથી ચુખી પોતે હરિજન;
સધળે દ્વારા, એ પૂજ પ્રભુ કેરી,
હેઠીને હુભવે તે કૃષ્ણનો વેદી...સેવો. ૨૬

ફુલ વંદન ભક્તિ ફુલ

એકવાર પ્રભુામ શ્રીકૃષ્ણને, જન્મ પરી કેણે દીવી;
અધ્યાત્મેવ દરા અવલૂચના, કૃતી પર પગ તેણે દીવી.

પગ દીવી શા માટે કહેવાય ?
થર કરે તોએ જન્મ તો થાય;
કૃષ્ણ પ્રભુમીને નહિ દેહ,
અખથી અધિકતા એમાં એહ...સેવો. ૨૭

નમન કષ્ટું નંદાલને, સનેહે મન-કુમ્ભ-વચને જેણે;
ધર્મ-સાર્વન પૂજું સહુ કર્યાં, નિશ્ચે જાખુલે તેણે.

તે છું કચું હરિ પદ આ નું હું બા,
હુંથ પા પનું ટાજચું મૂળા;
દીન બાવે કચું વંહન હરિને,
તે જનની ગર્ભ ન આવે ફરીને...સેવો. ૨૮

કુ દાસ્ય અહિત **કુ**
દાસ પલ્લામાં સોલાય છે, પતિ પુરુષોત્તમ કેને આશે;
બધી છતે વિધવા પલ્લ, અહા ઝાની માનું મન સાથે.

મન આશે માને લે હું જ ભૂપ,
જગત પૂજે જાણી રાધીનું તૃપ;
પલ્લ પતિ - સુખ સ્વભો નહિ એને,
એને એ અથડાય છે શેને ?...સેવો. ૨૯

દાસુખલું કે જાનાંદ છે, તે નથી ભાષ્યે જગાદીશ;
આનીનું ચુખ અનું જાણું, પાદ-આશે છેદાવે શીશ.

શીરા છેદા પછી મુકુટ કથાં ધારે ?
અહુ મૂર્ખ કોઈ મનમાં ન વિચારે;
અણને તે શ્રી જળ પાતનો સ્વાદ ?
અન બુદો રહી પામે આહુલાદ...સેવો. ૩૦

અન અજ ધારે નહિ, થારે તો અજ્ઞાનાંદ કોઈને;
બાજ્ઞાપલ્લ કે જાનરો, તો શુદ્ધ રહ્યો કહો શાને ?

જાને કહો ‘ન્યારો નથી અજ નામી’,
કથમ બોલ્યો જનક સાચુલચતા પામી ?
બેસે તે બીજો કહેવાય,
દુશ્શર જીવ કદી નવ થાય...સેવો. ૩૧

ફ સાંય ભક્તિ ફ

મહોદોભાગ્ય - મહોદોભાગ્ય, ધર્મ વજન પરમ પવિત્ર;
પૂજું અજ્ઞા સન્નાતન, પરમાનંદ થયા જેના મિત્ર.

મિત્ર થઈ સર્વે સુખ દીધું,
સર્વે આવે કારજ બહુ કીધું;
શૈવ - મહેશ - વિધિ - શ્રી - અલભ્ય,
તે ફળ શ્રી ગોપીજન - લભ્ય...સેવો. ૩૨

ફ આત્મ - સમર્પણ ભક્તિ ફ

દેહ, પ્રાણ, ધર્મદ્વય, અંતઃકરણ, ધર્મ, દારા, ચુષ, ધંન;
પુત્ર, આરોત, આત્મા સહ, સર્વે સમર્પું જગલુયાન.

જગલુયાન ને, સર્વા તમ ભાવે,
સેવા કરે સહા સહજ સ્વમાવે;
તે જગમે પ્રલુબ જ્યમ સુખી થાય,
આત્મ નિવેદન એ કહેવાય...સેવો. ૩૩

સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેંન સમર્પે ?
આત્મા સહિત અપ્રલુબી કરી, હરિદાસ યાની શીદ ઉર્પે ?

કરે છે કાળથી, રહે છે બિચારે,
ને પરનું માન્યું પોતાનું તે માટે;
જેથી બંધાયો તે વસ્તુ હે મૂકી.

તારી ન જાણુિશ - રાદ એ ચૂકી...સેવો. ૩૪

ફ પ્રેમ લક્ષ્મા ભક્તિ - સ્નેહ અને એની ચાર અવસ્થા. **ફ**
૩૫, ચુણુ, દ્રષ્ય, ત્રણ એ કારણું પ્રીત પચાનાં કહાવે;
એ ત્રણ વિકાર રહિત સહજ 'સ્નેહ' તે કૃષ્ણને ભાવે.

આવે, એ પ્રેમે વહાલો વશ થાય,
તેને મૂડી દાણું દુરે ન જાય;
તે જેને સુખ આણું મન એહ,
જ્યામ ત્યમ થાય સુખી પ્રજ્ઞા તેહ...સેવો. ૩૫
પ્રેમ, આસંક્રિયા. બ્યાસન, એ ગણે રૂપ સ્નેહના લહિયે;
ન રૂપર ચાથી તામયતા, તે બડી કાંઈ ન કહિયે.

કહિયે 'પ્રેમ' તું લક્ષ્ય એહ,
જ્યારે મળો ત્યારે તેનો તે સ્નોહ;
વિદોગ થાય ત્યારે તપે તન,
ત્યાંતું ત્યાં વળાણું રહે મન...સેવો. ૩૬
અંક વાર આખા હિવસમાં પણ, મહયા નિના ન રહેવાય;
એ ન મળો તે વિકળ થાય, 'આસંક્રિ' એ કહેવાય.
કહેવાયે બ્યાસન, આંતું જ્યારે થાય,
આ આ સા મી હું થ વીં ધા ય;
'ન-મયતા' તે મૃત્યુ સમાન,

આ ચારે આવે, આપે હરિદાન...સેવો. ૩૭
પ્રેમ-લક્ષ્યલો વળી, રૂગરચિ સમુતિ અલિલાપ ઉદ્ગચાર;
ચ્યાંદ, પ્રજ્ઞાપ, ઉંમાદ, ગણે 'આસંક્રિ' ના પ્રકાર.
પ્રકાર 'બ્યાસન' તણ્ણા એ કહિયે,
જકતા ને વળી મૂર્છા તે લહિયે;
'ન-મયતા' તું લક્ષ્ય એ ક,
મૃત્યુ-સાહુરથ, પણ મરણ ન છેક...સેવો. ૩૮

જાતિ જુદે તો આહીરની, તેમાં અધળા અધમ અતાર;
એ વેદાદિ નહોંતી ભાવી, નહોંતો ઉત્તમ કર્મ અધિકાર.

અધિકાર વિષુ એક પ્રેમ - પ્રતાપ,
કર્યા આધીન શ્રી કૃષ્ણાલુ આપ;
તે ગોપી - પહરજ વહે હશા,
'પ્રેમવક્ષણુ' તે ખાડુને શીપ...સેવો. ૩૬
સેવા - સંગત હરિ ભક્તાની, કરે 'પ્રેમ - ભક્તિ' ઉત્પન્ન;
તે કરે કૃતાર્થ એકલી, નચ લોકુંચે કોઈ સાથન.

લોકુંચે ન વય, વિદ્યા, વિત્ત, વર્ષ,
રૂપ, પરાકર્મ, પવિત્ર આચરણ;
કલેરો, લોયા નથી, કલો કિયે ઠામ ?
તો સુણ્ણા પ્રગટ બતાણું નામ...સેવો. ૪૦
બ્રુદ્ધાને ક્યાં વય હતું ? ક્યાં હતું સુદામાને વંન;
કુલાને રૂપ ક્યાં હતું ? ઉઅસેનમાં શું પુરુષાતંન ?

પુરુષ પાતન નોંધો તું ઉચ્ચ રાય,
ગર્જાને કચાં હતી અધ્યાત્મિકાય ?
પારખીમાં કચાંથી શુભ આચરણ ?

ક્રીબી ભક્તિ પાખ્યાં ગિરિધરણુ...સેવો. ૪૧
ક્રાદ્યા ગુણ - સંશુદ્ધ છે, દ્વિજ પરિત સરખે કોય;
પડ્યાનાભ-પદ વિભુષ છે, તો તેથી શ્રુપ્ય ભલેરો હોય.
શ્રુપ્ય ભલો જોહને કૃષ્ણાભક્તિ,
મન - કર્મ - વચને કરે કૃષ્ણ ભક્તિ;

કુળ અહિત શ્રેષ્ઠ પામે તેહ,

વિષ શાડે ન કરી શુદ્ધિ હેહ...સેવો. ૪૨

આ કૃષુની ભક્તિ અંક છે, બીજા સાંચન સર્વે શુન્ય; અંક વિના સાહુ અંકળ છે, સાહ શુન્ય શુન્ય દશ ગુન્ય.

દરા ગાયું અંદુ, આદ્ય અંક એક,

અંક વિના સુની શુન્ય અનેક;

ભક્તિ કરી તેણે સર્વ કાંઈ કીધું.

ભક્તિ વિના સર્વ કાંઈ ન સીધું...સેવો. ૪૩

જગ ભૂપે ગોદાન કર્યાં કેલાં? કાંઈ ગાયુંનાં ન આવે પાર; અંક દિવસ અણુ દોષ પદ્ધો, હૃકલારા થયો અવતાર.

અવતાર અધિમ, થઈ જગ હાસી.

ગોદાન - પુછુય ગયું કથાં નાસી?

દાન કર્યાં તોયે પામ્યો દુઃખ,

શામાટે? જે હતો ભક્તિ - વિભુષ...સેવો. ૪૪

પ્રાચીન - બહિંધ ભૂપતે, જીઓ કીશા બજા અપાર; તીવી અખાંકિત સૌ કરી, તોહે કાંઈ ન દીકો ચાર.

સાર ભાગ્યો, જે જે પશુ પાડયાં,

તે તે રહ્યાં હણુવા, નારેદે દૈખાડયાં;

ભય હેખી લીધું સુર - ઝડપ શરણુ,

ભક્તિ કરીને પામ્યો હરિ - ચરણુ...સેવો. ૪૫

ભક્તિ નારે આંદાળને, જેમાં એકો ન શુભ આચરણ; તો શું કહેનું પહી તેહનું, ઉદ્ધારે અધિમ અન્ય વણું?

વણું સર્વે ઉદ્ધારે જક્તા,

નીચ ઊચ કે નિજ - આસક્તિ;
એક આગ ભક્તિ બદ્રદાય,
આશ્રય શું પૂણ શ્રેષ્ઠ થાય?...સેવા. ૪૬
ભક્તિ નોકા તારે સર્વને, કે કો શરણે આવે શુદ્ધિ-પાપી;
અન્ય સાધન દાર્શનાંબિકા, મહે સભય તરે કો કદમ્પિ.
તરે કદમ્પિ, અચે કામાઈ આહથી,
સામદ્ય નહિ આણુ તારવા સાથી;
વિષુધ વિચારી જુઓ નિજ મંન,
ભક્તિ ભડી કે સાધન અન્ય?...સેવા. ૪૭
ભક્તિ મણિ, જ્ઞાન દીપ છે, રાગે ઉભય ખરા અંધકાર;
મળિ અભય, ધૂતિ અચળ છે, દીપકને તો ભય છે અપાર.
અપારે ભય વાયુથી વામે,
તૈલ - પાત્ર ભર્તી વણુ લય પામે;
જ્ઞાન સભય તો અન્ય કોણુ માત્ર ?
નિર્બંધ ભક્તિ સંકળ મુખ-પાત્ર...સેવા. ૪૮
ભક્ત તે ભક્તિ સ્વરૂપ છે, તેને માયા ન પીડે લેશ;
ઓ ઘડી ઓ મહોવાય નહિ, મેહ પામે પુરુષને વેશ.
પુરુષ જ્ઞાન વૈરાગ્ય ને ચોગ,
તેને પીડે અજ - રૂપી રોગ;
તે કારણુ અદ્ય થાય છે તેહ,
ભક્તાને અચળ હરિશું સ્નેહ...સેવા. ૪૯
નિરખે નેત્ર નંદાલને, શુતિ કષા, રદે મુખ નામ;
નાસિકા સુંબ પ્રેમશું, પ્રસારી તુળસી પુરુષ-દામ.

હામ ઘાણુ કરે, કર હરિ - સેવા,
દોડે ચરણુ પ્રજ્ઞુ - હરીન લેવા;

મને ઈધાન નટવર - છબિ શ્વામ,

સર્વાંગે કરે પ્રજ્ઞનેહંડ - પ્રખ્યામ...સેવા. ૫૦

અંગીત વિના કેવળ ઇતિ કરે, તેને ઇણ પરણોકે ન થાય;
નર્મલભર પવનભક્તી રહે, બુદ્ધો મર્યાદ તીર્થે જળ - હાય.

મીત તીર્થ, લીલ - મૃગ વન વાસી,

અંધે અહે હંડ, કોસાહ જાય કાશી;

અર્પ હંડવત, નટ ભસ્ય - વેશ,

દરશા તપોધન, ભાવ ના લેશ...સેવા. ૫૧

ઝ અઙ્ગીત - મહિમા ઝ

શ્રી હંદુ. શ્રી ગુરુ, અગારદી, એ નણે એક સ્વરૂપ;
નળ વારા જયમ સુરસરી, તેમાં બેઠ નહિ તરૂપ.

બેઠ નહિ, ગ્રધુ નામ જ માત્ર,

બેતાં વિચારી દીસે એક જ ગાત્ર;

સ્નેહ વિવેકે સેવા, આરે આર્થ,

અત્મભુત અમૂલ્ય ખુદો શિદ વ્યર્થ?...સેવા. ૫૨
અસંગ અર્દેનો સાર છે, તેનો મૂઢ ન જાણે અર્મ;

અર્દીપ દીપ મળે થયો, દીપ સમતા મળી વણુ અમ.

શ્રમ વિના શ્રીનાથ ભિલાવે,

કંપનુ કામ તે પલકે અરાવે;

જયમ નીચ નીર અળતાં ગંગે ગંગ,

એમ સમોવં હે સત્સંગ...સેવા. ૫૩

લવ હરિ સંગીતા સંગના, સુખની સમતા નહિ કોય;
સ્વર્ગ તથા અપવર્ગનું, સુખ પણ સમ્માવણ નવ હોય.

નવ હોય સુમતા મોક્ષાનંદ,

તો કેચાં જન ધરિછત સુખ મંદ?

અણુ - અનુભવીને આક્ષય થાય,

પણ વાણુ સહેઠ છે નહિ, રાય...સેવો. ૫૪
ગંગાલુ હરે પાપને, શરીર તાપ હરે ગયે શરણુ;
દાસ્ત્ર્ય ટાળે સુરતરુ, ભળી ગણુ કરે ગણુ હરણુ.

હરણુ કરે ગણુ તે તલ્કાળી,

મળતામાં હરિજન દ્વારાણઃ

ઝાને તાપ હણુ, દર્શાને હોપ,

હૃદય ટાળે ઉપલાવી સંતોષ...સેવો. ૫૫
યોગ, યજ્ઞ, જ્યોતિ, તપ, પ્રતો, બહુ કીધિ કષ્ટ કર્મ;
જ્ઞાન, દ્વારાન, અતિ દાનથી, તીર્થ, આચરતાં ધર્મ.

ધર્માદ્યયયન, વેદ, શાસ્ત્ર પુરાણ,

કોટિ સાધનથી ન પરમ કદમ્બાણુ;

શ્રેષ્ઠ નવ થાય ઉપાય અનેક,

વિના મહતુ પદ-રાજ-અભિપ્રેક...સેવો. ૫૬

હરિજન તે હરિ - રૂપ છે, તેને મૂર્ખ નિજ સમ જાણુ;
જ્યોતિ શરીર સાગરમાં હતો, માન્યો મીનેતે મીન પ્રમાણે.

મીન પ્રમાણે થયો નહિ સોમ,

માટે રહ્યું બોમ ને તે વસ્યો વ્યોમ;

ત્વામ વૈષણવ તે વૈકુંઠે જાણો,

અધ્યમ અહીં ના અહીં અથડાશે... સેવો. ૫૭
ચાર વણું માં એંક સવીધી, આજાણ વળું વિખ્યાત;
તે સહુના પણ કહાવે શિરેમણિ, મોટા મુનિવર જાત.

તે સાતે કરે પ્રુવની પરિકુદ્મા,

પ્રુવ સુત - કૃતી ને તે સુત ખ્રદા;

વિષુધ, વિચાર કરો તમે એક,

અક્ષા મોટા કે આજાણુ - હેઠ ?... સેવો. ૫૮

અભાદ્રિક પજ-બજાની, ૫૮-૮૮ વાં હે ગુણ ધામ;
દુર્વાસા ઝડપિએ હીન થઈ, કર્યો અભરીપણે પ્રલૂભ.

કર્યો પ્રલૂભ જ્યારે અથડાયા,

વળી શાખારી પદ - જળો દ્વિજ નાણા;

હરિજનથી મોકું નથી કોઈ,

દૂભરે તે દુઃખ પામે, પત ઐય... સેવો. ૫૯

સંત સેવે નારદ થયા, જુઓ દાસીસુત હરિમંન;
તે સુર ઝડપિના સંગથી, રણી વ્યાસના ઉરેની અગંન.

અગંન મટી, અમણલયો મર્મ,

શ્રી કાગવત રચ્યું છાંડીને કર્મ;

કશેરા ટળો, કરે પ્રલૂભન - પ્રીત,

દૂભર્યેથી સાતે સુકીત... સેવો. ૬૦

યોગી તરે કદા એકલેટ, હરિજન તારે સહુ સંગી;
સિક ઉદાસી રહે સદા, હોય સંત સુંદર રસ રંગી,

રંગો રચિક સેવે ગુણ ગાય,

યોતે રિથે સુધા, આમાને પાય;

ભક્તા સ્નેહી સૌનું કારે કામ,
દ્વાની આશી કોઈનો નહિ કામ...સેવો. ૬૧

ફુ કર્તાય - નિરૂપલું ફુ

સર્વો પ્રાણી ઉપર દ્વા, આખુંદો નરિદ કોઈનો દોપ;
વર્ષ કરવી ઉદ્દિય સહુ, યથા લાભ સંતોષ.
સંતોષ ધરી વહવી સત્ય વાણી,
હૃદ આશ્રય-પ્રભુ દીનતા આણી;
હુદ્દ સંગથી રહેણું દુર,
વસ્તું સદા હરિજનની હજૂર...સેવો. ૬૨

હુદ્દ સંગત તેને જાળ્યાપે, જે જુલાવે ભગવંત;
રનેહ હરાવે હૃદાશુ, તે તો કહ્યે સાચા સંત.
સંત સાચા તેની સંગત કરિયે,
અમૃભર્પિત અન્યાશ્રયથી હરિયે;
'હુ' હરિનો 'હરિ મારા નાથ',
એ નિશ્ચે કરવું મન સાથ...સેવો. ૬૩

અન્યાશ્રય અસમર્પિત, એ બે મારા દુસ્તર રોગ;
સર્વો વસ્તુ શીનાથને અપી, ઉર્ભિલાં કરવો ભોગ.
ભોગ કરવો હરિ-ભક્તાની સંગે,
એક જ શી હૃદાણુ સેવવા રંગે;
હૃદ આશ્રય ગુરુ હેવનો ધરવો,

(તો) ગોવત્સ-પદ્ધત્ત ભવદ્ધિતરવો...સેવો. ૬૪
ગુણની ઉપર શુદ્ધ કરે, એ તો રીત જગતમાં પ્રકારા;
અવગુણ સામો શુદ્ધ કરે, તે મેરા હરિના દાસ.

દાસ હોય સહુના સંતાડે,
ગુણુ હોય રાદ્રે તે આધિક હોમાડે;
સાગર-લાંછન વિષ શિવે પીંખું,
શરીર-ધરા પ્રગટ લાટે દીંખું...સેવો. ૬૫

નિર્બંધર વશ તેણને, કેનું ચિત્ત સહા પ્રલુબ પાસ;
હિત હુંછે સહુ જગતનું, નવ ધરે કોઈની આશ.

આશ કરે એક શ્રી ગોપાળ,
ધતીર કરે હરિ-સેવામાં કાળ;
સેવે ગુરુનો લઈ ઉપદેશ,
ધરિયે સાચો વૈષ્ણવનો વેશ...સેવો. ૬૬

ઝ ગુરુદેવનું આહારય ઝ

ધાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજાનનું મૂળ ગુરુ-પાય;
મંત્ર મૂળ ગુરુ-વાદ્ય છે, મૂળ માધ્યનું ગુરુ-કૃપાય.

ગુરુ કૃપા વાંછિત ઇણ થાય,
હરિ રૂપે તો ગુરુ કરે સહાય;
ગુરુ કોપે કૃચહું નહિ ઠેકાણું,
આધિક આચાર્યથી કો નવ લાણું...સેવો. ૬૭

કાંધી ગુરુ તો રૂસિંહલુ, કાંધી હોય તો કૃષ્ણ કદિયે;
ઓદ્ધ દાખે તો વામનલુ, પણ હરિ સાચા એ લહિયે.

લહિયે એ પાખે હાખે જો કૃહૃત્ય,
તો પણ માનિયે એ થકી ગત્ય;
જેણું સોંપી આચારા જગદીરા,
તેનો જાણી સહા તે શિષ્ય...સેવો. ૬૮

ફ અતાય શરણુંના પ્રતાપ **ફ**

બેઠાન - વસનની ચિંતા કરી, વૈષ્ણવને ન પાડું ઉદાહસ;
વિધીંભર પૂરે વિધને તે, કયમ ભૂલે નિજ હાસ ?

દાસ - આરી પૂરે ખાહું વણુ - માંથે,

વણુ કેણે સહાય કરે અનુરાગે;

હરિ જગતાં કાંઈ નવ રહે ખામી,

નથી અળણુથા એ આંતર્યામી...સેવો. ૬૬

અજાય ગુલંમહેરી જળ વર્સે, પણ્ણિથી સુખ રહે હરિ નામ;

ખાન - પાન મોહે નવ કરે, છુટે સુખ ઘડી સુંદર શયામ.

શ્યામે વિચારી કચું તેહને સુખ,

ચરણુ ચરવા કર્યાં મધૂરેનાં સુખ;

પૂછે વહન કચું, તોટની શ્રીવા,

શ્રી હરિ ચુભિંતા કરી જળ પીવા...સેવો. ૭૦

અજાગરને અનાયાસ હરિ, આપે આહાર ચનમાં લાવી;

સકર ખારને સાકર, સાગર - બેટમાં કે છે મિલાવી.

મિલાવે આતુંને જળ - સ્વપ્તિ,

ગિરિ-શૂંગે વૃક્ષ પોષે કોઈ ભાતી;

ઝી - સ્તરને પથ કચું પોપવા થાળી,

તે તુંને નહિ ભૂલે, ભજ ગોપાળ...સેવો. ૭૧

અજા - મનોરથ સો પૂરે પ્રભુ, કઠિન સરળ ચુરુ નાના;

બેહના પૂર્ણ તેનાં નામ કહું, તું પુછેશ કોહના કોહના.

કાહાન ગયા કુખણ - પતિ થાવા,

પારથ - પત્ની થથા જળ પાવા;

પુરી પુત્ર થઈ આહિતિની આરા,

પાંડવ - કાંખે કર્યાં થઈ દાસ...સેવો. ૭૨
હડીહાર ઉમસેનના, થયા દ્વારપાળ બલિ-ભૂપ;
નરસેયાના બાપટું શાદ કર્યું, સેના માટે નાપિક-રૂપ.

૩૫ - મ હારે દામાળ ચારુ,

નામાનું છાપડું છાયું ચારુ;
વારિ વહું ત્રિલોચન ઘેર,

મીરાં બાઈનું પીખું તેર...સેવો. ૭૩
કુંભ રૂડું પ્રભુ જગતનું, તે કથમ કુંડ કરે નિજ દાસ ?
જે કરશે હરિ તે ભલું તાહેર તું ધર દૂદ વિદ્યાસ.

વિશ્વાસ રાખ, ઠદ્ધના મૂક,

સેવા - સમર્પણું માં નવ વ્યૂહ;

નહિ મળો ઝરી અવસરે આવો.

હરિ ભલ લો મનુષ્યા દેહ લહાવો...સેવો. ૭૪
જે દુઃખ ચાયે હરિ સેવતાં, તો તે સુધા સમું પ્રમાણૂઃ;
વિપય બોગવતાં ચુંખ છે, તે વિપ સરખું સર્વ જાણૂઃ.

બાળ્યો જેમ અસ અણુતાં મીડી,

ક્ષાળું પછી આગ જીઠે અ'ગાડી;

ઓસડ પીતાં કંડુ તત્ત લાગો,

રોગ ગયા પછી આનંદ લાગો...સેવો. ૭૫
શ્રી જિંદિવરધર સેવતાં, ભય રાખવો ભૂપતિ સમાન;

આગક સમ વાત્સલ્ય ને, ધરવો સનેહ તો જર સમાન.

જર સમાન પ્રિય પ્રભુ લાગો,

તો હુંખ જ-મ - જ-મનાં ભાગે;

પ્રેમ - પીઠણ પીઠું તે જાળે,

નથી સ્વાહ કાઈ એક પ્રમાણે...સેવો. ૭૬

ઝ કર્તાય-અકર્તાય વિચાર ઝ

જે પ્રતિકૃતિ પ્રલુદ સેવતાં, તેને તજિયે, ના વળગિયે યથેં;
જનની, જનક, પતિ, પુત્ર, આત, ગુરુછાંડચા જરૂરિ સમથે.

સમથે તાત ત્યજયો પ્રહૃદાદે,

ભરતે આત મૂકી હરિ સ્વાદે;

પતિ અદ્ધિ પતની, વિલીધણુ જ્ઞાત,

ગુરુ ના ગાંધુયા અદ્દિયો સાક્ષાત...સેવો. ૭૭

ઝ શરણુ-માણાય ઝ

હેર પિત ને મતુય-કણુ, ત્યાં લગી માણુસને કહેવાય;
જ્યાં લગી સર્વાંમ-લાવે, શ્રી કૃષ્ણને શરણે ન જાય.

શરણે ગયે સર્વે નકણુ દૂટે,

ચિત્રગુભતનું લૈણું તુટે;

કાલ કેમનો ભય નહિ તેને,

શ્રીશ ધર્ણી સમથે હરિ જેને...સેવો. ૭૮

કરું અકરું અન્યથા કરું, સમથે શ્રી હરિરાય;

ના થાવાનો કરે પદારથ, થાવાનું મરી જાય.

મરી ગણું કો વસ્તુંને વિચાયું,

તે ક્ષણે વન, જે સમે રાજ્ય ધ્યાયું;

અધ્યાના સુત, એ વિકાળા જ્ઞાની,

દુર્ઘાલ્યો વચ્ચન, તેની પણ હાનિ...સેવો. ૭૯

અહંકુ કુળપતિ રાખરો, તેને હજુશે રૂં એ કુલવાળો ?
તે જ પુરુષ જ્યારે મારરો, ત્યારે કોઈ નથી રખવાળો.

રખવાળો - રિપુ છે નહિ કોય,

અધળી વસ્તુ શ્રી કૃષ્ણથી હોય;

કર્તા - હત્તા એક શ્રી મારરાય,

એના કર્યા વિના કાંઈ નવ થાય...સેવો. ૮૦

કું થાય શ્રી કૃષ્ણનું, કોથી ઘટે વધે નહિ લેશા;
ને જ પ્રમાણે સુખ-દુઃખ લાભાલાભ, ન સંશાય રેશા.

રેશા રહે નહિ તે સમે શુદ્ધિ,

બેનું હોનાર તેવી થાયે શુદ્ધિ;

થનાર તે સહેલે પણ થાય,

તું કર્તા નથી, શીડ પસ્તાય ?...સેવો. ૮૧

દારી જાતી, તું જાત છે, તેમ વાજે વળું જ્યામ;
કાઇ પૂતળી ગુણ કરે, સૂત્રધાર નચાવે ત્યામ,
ત્યામ વિધિ - નિષેધ સૌ દરિ - હાયે,

તું મિથ્યા તાણી લે શીડ માયે ?

વિચાર, લે લુલનું કું હોય,

તો દુઃખી જગતમાં થાય ન કોય...સેવો. ૮૨

દેની રચના લોઈને, બણો મોહુ ઉપજે છે મંત;
ને કાંમાં શ્રી કર્મી હુશે ? તું દેની વિચારી જાત.

જાત, પૂર્ણ મનોરથ થારો તાહારો,

ઘાટે શું મોહો ? તું લે ઘડનારો;

તેને માયે પૂર્ણાનંદ થારો,

ભવ વૈભવ તૃપ્તિં ટળી જારો...સેવો. ૮૩
કરવા પ્રસત્ત ચાહે પ્રભુને તો, અભિજાત અળગું નાખ;
શીખ દ્વારા કેશવ તણી છુંછે, તો તું દીનતા રાખ.

રામ દીનતા એક જ કરીને,
કરવા કૃપા મન થારો હરિને;
ઓચોર કોટિઓ સચું ન હામ,
દીનતા એક બાધાયા હામ...સેવો. ૮૪
શિક્ષા જુદ્ધ શાલિમામભાં, હરિ-સવરૂપને ધારુ પ્રમાણે;
મનુષ્ય લહે ગુરુ હેવને, જાતિ-જાવ વૈભુવભાં આણુ.

આણે ભાગ પ્રસાદ ભતી-આજ,
હરિ ચરણ્ણોહકે પ્રીતી વંન;
અન્ય વરણું સમ લહે હરિ નામ,
ઇત્યાહિકનાં નરકમાં હામ...સેવો. ૮૫
નિગમ ચાર, અરૂશાસ્થ, અધ્યાત્મા પુરાણ, ચૌદ વિદ્યાય;
વ્યાકરણ નવ, બગ્રાંશા (વળી) લક્ષણું, બાળે ચાસંડ કળાય.

કળા, રાગ છવીરો ગ્રાય,
વિશાદ કીર્તિ ચક્રવર્તી રાય;
પણ નથી ભક્તિ બે નહુકુમાર,
તો સહુ ધૂળ મળયું ઘિરું...સેવો. ૮૬
અમ કરી સહુ વિદ્યા ભર્યો, ભર્દા પંચિત કહ્યાયો જકા;
પણ તેનો સાર સમજ્યો નહિ, (બો) ન થ્યો અગત્ય ભક્તા.
ભક્તિ વિના અમ અકળ સૌ સાર,
જયમ રાસભ વહે ચહેન - જારે:

જ્યામ આહિ મણ્યુ-ધૂતિ મેળવે આહાર,
ત્યામ તે ઉદ્દર ભયું, ધિક્કાર...સેવા. ૮૭
નૃપરાં મણ્યના પુર વિશે, રંગું ચિંતામણું મય ક્ષામ;
કદ્મય વૃદ્ધની વાં, ગાય બેર કામદૂધા કેદનું નામ.

કામદૂધા, અસ્ક્રય પાત્ર આતૂલ,

નવ નિધિ, આણ મહા સિદ્ધ અતુકૂલ;

પણું નથી વહેલાં જે શજનાથ,

તો એટલું મળ્યે ઘસવા હાથ...સેવા. ૮૮

કૃષ્ણ કીર્તન નહિં કણું માં, તે તો અવણ રાંડા કહિયે;
નિરાસા નહિં જેણું નેત્ર હરિ, કોંકિ પિરું ચાંદા લાલિયે.

લાલિયે હાદુર-જિહુંવા હરિ નવ બોલે,

કર - પદ સેવા રહિત શાખ - તોલે;

વૃદ્ધ - લિંગ શ્યામ ધ્યમણું સમાન,

આમ - શુદ્ધ સમ છે ખાન - પાન...સેવા. ૮૯

જગ દ્વર્પણું જોનાર તું, સાહાસું દીસે જેહેણું તુજ પાસે;
દુષ્ટે દુષ્ટ, સાહુને સાહુ, ભવ - આદર્શાં ભાસે.

ભાસે તે સૌ નિજમાં છે જાણો,

હોથ રહિત હુનિયા પરમાણો;

ઓહ વિવેકે જે રહેવાય,

તો રાગ - દ્રોષ નવ કેં થકી થાય...સેવા. ૯૦

ઝર સર્વ હરિ - અંશ છે, તેનાં વિચિત્ર ભાંતિ સ્વભાવ;
સર્વથી હળવીમળી ચાદીયે, આ તો છે સંભેગ નદી નાવ.

નાર - તરંગ = નહી એમ જાણો,

કોથી ન અગાડ, બે હિનનો પ્રાહ્લાદો;

સહુને સહા એક સ્થળ નથી રહેવું,

કદુક વચન માટે કેદને ન કહેવું...સેવો. ૬૧

પ્રભુ પાસે કંઈ તા માગિયે, માણ્યે પસ્તાવો થાય;
ઉદાસી આવે નાથને, વેપાર સરીખું જલ્દાય.

જખ્યાય એહેવું માટે રખે જાઓ !

સેવો શ્રી કૃષ્ણ ધરી સનેહ સાચો;

વણ માણ્યે સહુ આપે એ સ્વામી,

નથી અલઘુયા અંતથામી...સેવો. ૬૨

દાસીના સુતના સૌ પિતા, રાણી - સુતનો તો એક જ રાય;
ભક્તિ અંગ શ્રી કૃષ્ણ જ સેવે, ને માધિક સર્વને થાય.

ધારે તો યે કરે સહાય ન કોય,

કામ પડે ત્યારે આતે રૈધ;

આવા ગમનમાં સહા અથડાય,

કો કાળો હરિ વિના ગત્ય ન થાય...સેવો. ૬૩

નાહાનો પદાર્થ મોટો હેખાડો, ને પાડચાને હાથે કાચો;
ઉચ્ચ છોય તેને અછુ બતાવે, ને જુઠો મનાવે સાચો.

સાચો ભાસે એ જ માયાનું ઝૂપ,

એણો કીધા વશ રંક ને ભૂપ;

એણો જીત્યાનો છે એક ઉપાય,

માણું શરણું લણો શ્રી વજરાય...સેવો. ૬૪

માયા છે વંદી, ખીલડો હરિ, તેમાં જીવ ચરાયર અજ;
જે પદ્ધું તે પીસાય છે, તું જેની પ્રકટ જોયાન.

લોચને જે, એક બચે છે તેહ,
ખીંડ સમીપે, રહે છે જોહ;
જે આણુ ત્યાંથી ખરથો કણુ આધો,
તે તત્કાળ ફળાવા લાગ્યો...સેવો. ૬૫
ખરચારી સો કાખથી, કોઈ મૂલું ન પામ્યો જત;
આ દીકું છે, આ કરવું છે, એમ કરતાં આપણો અંત.
અંત આવ્યો હરિ કંચારે ગાણો ?

એત એત નહિ તો પસ્તાણો;
એ મરણું નહિ આવે કાને કહીને,
થણો આંધારું એચિંતુ થઇને...સેવો. ૬૬
દુનારે વચન તે ભાનવું, પૂર્વનું નહિ પ્રમાણ;
છદ્રનું રદ્ધનું શ્રી ભાગવત, સો પહેલાં રદ્ધાં અન્ય પુરાણ.
પુરાણું પુથક પુથક કર્યો વ્યાસે,
તો ચે રહેતું ઉર ભરિયું ઉદાસે;
મર્મ અતાંથો નારેદ મિત્ર,
'સુખ થાણો, રચો ભક્તિ-ચરિત્ર'...સેવો. ૬૭

ઘૂ, શાંકણુ ગીતિ... **ઘૂ,**
પૂર્ણ પથ - પ્રભુ શ્રી વદ્લલ કુળ, જધાએ લેને શારણ;
નામ નિવેદન - મર્યાદા ધરી, સેવિયે શ્રી ગિરિધરણ.

શ્રી ગિરિધરણુ - ગુરુ - વૈષણવ ખ્યાર,
ઉદ્ધારે, ગતિ કરે માર્ગ ચાનુસાર;
મનુષ્ય જ-મનો એ છે સાર,
જે માને તે પામે પાર...સેવો. ૬૮

ફું અંથ - રચન - પ્રયોગન ફું

મહામંદિર-મતિ જીવ કલિના તે, સર્વશાસ્ત્ર કૃપાં ખોણે ?
માટે સકળ સિદ્ધાંત-સાર, શોધી કીદો છે ટોણે.

ટોણે કરાવ્યો પ્રભુ મતિ દીધી,
નિજજગત જાણીને કર્લણું કીધી;
'ભક્તિ પોપળુ' ધ્યું અંથનું નામ,
કથે, સુણો, મરે સર્વનાં કામ...સેવો. ૯૯

ફું ફલ - શુદ્ધિ ફું

એકસોં ને એક બંદ્રાવલાં, આ અંથ તથા છે સારે;
પ્રતિ પદ શુદ્ધ સિદ્ધાંત ભયું છે, વાંચીને કરણે વિચાર.

વિચારતાં વદ્ધાભ હરિ થારો,
સર્વ ક્લેશ સમુદ્ધા બારો;
આચરણ કરતાં આનંદની હેઠી,
અકિત શ્રી કૃપળુની કરણે હેઠી...સેવો. ૧૦૦

ફું કવિની એણાખ ફું

મહા નદી શ્રી નર્મદા-તટે, ચંડી-પુરી મહા બામ;
જાતિ નાગર સાહોદરા દ્વિજ, ભર 'દ્વારાંકર' નામ.

નામ વદ્ધાભી વૈષ્ણવ હાસ,
ગુરુ - પ્રતાપે કર્યાં અંથ પ્રકાશ;
શરીએ આંખો જે જન ગાય,
તેને જન-વાંચિત ઝળ થાય...સેવો. ૧૦૧

(અકિત કવિ 'શ્રી દ્વારામભાઈ' કૃત ભક્તિ-પોપળ સમાપ્ત)